

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૦૪ ઓક્ટોબર ૨૦૨૩, બુધવાર
વિક્રમ સંવત ૨૦૭૯, ભાદરવો વદ ૧૬

વર્ષ : ૧૫
અંક : ૬૯

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ માપવામાં આવી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા

પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધૂજતી જોવા મળી હતી, નોર્થમાં ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા

1 નવી દિલ્હી, તા. ૩ |

મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ માપવામાં આવી હતી. પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધૂજતી જોવા મળી હતી. નોર્થમાં ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને બરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ઉત્તરાખંડની ધરતી પણ ધ્રુજી હતી. અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે ૨.૫૩ વાગ્યો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે ૨:૨૫ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી ૧૦ કિમી નીચે હતું.



અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ટ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉજા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ. રિક્ટર સ્કેલ પર ૨.૦ થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના ૮,૦૦૦ ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેની જ રીતે, ૨.૦ થી

૨.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપોને માર્શનૌર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા ૧,૦૦૦ ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. ૩.૦ થી ૩.૯ ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત નોંધાય છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો ૪.૦ થી ૪.૯ તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ ૬,૨૦૦ વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ધરતી વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મંગળવારે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા ભયંકર હતા કે લોકો ઘર અને ઓફિસોથી બહાર દોડી આવ્યા હતા. મંગળવારે એક-બે નહીં ચાર ભૂકંપ આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં હતું. જે ભૂકંપના આંચકા અનુભવાયા તે અડધા કલાકમાં બીજી વખત આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે દિલ્હી, ઉત્તરાખંડ સિવાય નેપાળમાં પણ આંચકા અનુભવાયા.



અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ

ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ

જે ધીના ડાહ્યાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે, અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઈ હોવાની રાડ ઉઠી છે

1 બનાસકાંઠા, તા. ૩ |

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ધીના ડાહ્યાના સેમ્પલ ફેઇલ થયા

છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઈ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ધીના સેમ્પલ ફેઇલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક ડિવેસો પહેલા લીધેલા ધીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટેડર્સમાંથી ધીના સેમ્પલ લીધા હતા.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી ન્યૂઝકલિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દિલ્હી પોલીસના દરોડા પાડ્યા

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી ઘણાભંધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઇલ જેવા સાધનોને જપ્ત કર્યા

1 નવી દિલ્હી, તા. ૩ |

આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝકલિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોર્થ અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે ૩૦ જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની



સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાભંધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઇલ જેવા સાધનોને જપ્ત કરાયા છે. પત્રકાર અભીષેક શર્માએ આ ઘટના અંગે

જાણકારી આપી કહ્યું કે, દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી. મારું લેપટોપ અને ફોન જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લઈ લેવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલે આ મામલે યુએપીએહેડેડળ કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ છે કે, આ વેબસાઇટમાં ચીનની કંપનીઓએ ફંડિંગ કર્યું છે. આ પહેલા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે ઈડીએ પણ કાર્યવાહી કરી હતી.

કાશ્મીરમાં આતંકીઓ સામેનું અભિયાન તેજ રાજૌરીના કાલાકોટ જંગલોમાં આતંકીઓને શોધવા સેનાનું સર્ચ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

1 જમ્મુ, તા. ૩ |

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઈ હતી. જે મામલે આજે વહેલી સવારથી જ આ જગ્યા પર સેનાનું સર્ચ માટે સર્ચ ઓપરેશન તેજ બનવામાં ગતિવિધિની માહિતી મળ્યા બાદ,

સેનાએ પોલીસ સાથે મળીને વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં ધ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. મળતી માહિતી અનુસાર, રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની શોધ માટે સર્ચ ઓપરેશન તેજ બનવામાં આવ્યું છે.

1 નવી દિલ્હી, તા. ૩ |
બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી ૬ તારીખે સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ શકીએ

ભારતે કેનેડાને તેના ૪૦ રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ કર્યો

1 નવી દિલ્હી, તા. ૩ |

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ૪૦નેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાનમાં તસ્કરોએ ૩૨૮ લોકોની કિડની વેચી નાખી

1 ઇસ્લામાબાદ, તા. ૩ |

પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ગરીબીથી પરેશાન લોકો હવે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. લોકોની ગરીબીનો કાયદો ઉઠાવીને હવે તસ્કરો કસાઈ બની ગયા છે. પાકિસ્તાનમાં ૩૨૮ લોકોની કિડની કાઢી હોવાનો ખુલાસો થયો છે. ખાસ વાત એ છે કે,

એક કિડનીને એક-એક કરોડમાં વેચવામાં આવી રહી છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ગરીબ લોકોની કિડની કાઢીને વિદેશોમાં ૩૦ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. તસ્કરોની ગેંગના લીડર ફવાદ મુખ્તાર પર ૩૦૦થી વધુ કિડની કાઢવાનો આરોપ લાગ્યો છે. ગેરવર્તણૂકના આરોપમાં ફવાદ મુખ્તારની અગાઉ પણ પાંચ વખત ધરપકડ કરવામાં આવી હતી.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

LPGના ભાવમાં ઘટાડા બાદ ફેવેલ અને ડીડેલના ભાવ ઘટશે ?

સંતરામપુર જિલ્લા અને તાલુકાઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પત્રકારો નિમવાના છે સંપર્ક કરો

સંતોષકુમાર જોષી
મો. 63550 761743

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

LPGના ભાવમાં ઘટાડા બાદ ફેવેલ અને ડીડેલના ભાવ ઘટશે ?

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં માનદ પત્રકાર નિમવાના છે સંપર્ક કરો

મનિષ પ્રજાપતિ
મો. 88493 69594

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઇટ

આજે જ cnngujarat.co.in વેબસાઇટ ઉપર વિઝીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

CNN
CHANNEL NINE NETWORK GUJARAT
Gujarati Daily News Paper

LIVE
cnngujarat.co.in

રાજકોટમાં ભેવડી ઋતુને લઈ રોગચાળો વકર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રોજના ૨૦૦ થી વધારે વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ આવી રહ્યા છે, જે રીતે દર્દીઓની કતારો જામી રહી છે



રાજકોટ, તા.૩ | રાજકોટમાં રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વાયરલ તાવના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. હાલમાં મિશ્ર ઋતુ હાલમાં અનુભવાઈ રહી છે, આ દરમિયાન રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉભરાઈ રહ્યા છે. સોમવારે પણ દર્દીઓની ભીડ ઉભરાતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિવિલમાં રોજના ૨૦૦ થી વધારે વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ આવી રહ્યા છે. જે રીતે દર્દીઓની કતારો જામી રહી છે, તેના કારણે દર્દીઓના માટે કેસ બારીઓ પણ ઓછી પડતા વધુ બે હંગામી કેસ બારી માટેના કાઉન્ટર બહારની સાઈડમાં ખોલવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય એ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ફોગીંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે.

ઓછા વજનની સોનાની ચેઈન આપી દાગીના લઈ ફરાર ઠગભાજ ઝડપાયો

આ ઠગભાજનો ફોટો જ્વેલર્સના માલિકે સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ કર્યો તેના આધારે ઠગભાજ ઝડપાયો

સુરત, તા.૩ | રાજ્યમાં અવારનવાર ઠગાઈની ઘટના સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર ઠગભાજો અલગ અલગ પ્રકારની ઠગાઈ કરતા હોય છે. આવી જ એક ઠગાઈની ઘટના સુરતમાં બની હતી. સુરતના સરથાણામાં દોઢ મહિના પહેલા ઓછા વજનની ચેઈન આપીને ૭૫ હજારના દાગીના પડાવી ગયેલો ઠગભાજ ઝડપાયો છે. ઠગ યુવક બીજાવાર છેતરપિંડી કરવા આવતા જ ઝડપાયો હતો. આ ઠગભાજનો ફોટો જ્વેલર્સના માલિકે સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ કર્યો હતો. તેના આધારે ઠગભાજ ઝડપાઈ જતા પોલીસના હવાલે કર્યો હતો.

રેસીડેન્સીમાં રહેતા ૩૩ વર્ષીય જેમીનકુમાર નથુભાઈ શિરોયા સરથાણા યોગીચોક કિનારા રો હાઉસ દુકાન નં. ૧૩ ખાતે દિલીપભાઈ નાકરાણીની માલિકીના નાકરાણી ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. દોઢ મહિના પહેલા એક વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો. આ યુવકે સોનાની ચેઈન બતાવી તેના બદલામાં બીજી સોનાની ચેઈન અને પેન્ડલ લેવાનું કહીને ૭૫ હજારના દાગીના ખરીદી લીધા હતા. અજાણી વ્યક્તિએ આપેલી ચેઈન તપાસ કરતા તે માત્ર ૭૬૦૦ રૂપિયાની જ નીકળી હતી. આ બાબતે જેમીનભાઈએ પોતાના શેઠને જાણ કરી હતી. બીજી તરફ અજાણી વ્યક્તિનો ફોટો જ્વેલર્સના ગ્રૂપમાં વાયરલ કરી દેવાયો હતો. અને તેનાથી

સાવચેત રહેવાની સૂચના અપાઈ હતી કે, આ વ્યક્તિ ૨૦ કેરેટના માર્કિંગવાળી ચેઈન લઈ બજારમાં ફરે છે, ખરેખર તેની પાસે માત્ર આઠ કેરેટ જ સોનું છે. ત્યાં ફરીવાર આ યુવક રવિવારે બપોરના સમયે આવ્યો હતો અને એક ચેઈનની સામે ૧૮ કેરેટ વજનનું સોનાનું ડોક્યું પસંદ કર્યું હતું. ફોટાના આધારે જેમીનકુમાર આ ઠગભાજને ઓળખી ગયા હતા. તેઓએ તાત્કાલીક જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. થોડા સમયમાં જ સરથાણા પોલીસનો સ્ટાફ આવી જતા પોલીસ તેની ધરપકડ કરી હતી. આ ઠગભાજ વ્યક્તિ સરથાણા સંતેલવીદાસ સોસાયટીમાં રહેતો દિનેશ પ્રભુદાસ લશ્કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટનાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે. શોર્ટ સર્કિટ થતા તાત્કાલિક દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટના પગલે હોસ્પિટલમાં ધુમાડો થતા ૨ માળ ખાલી કરવામાં આવ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં વીજપુરવડો ખોરવાયો છે. શારદાબેન હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યા હોવાથી પાર્કિંગમાં ભારે માત્રામાં દર્દી અને તેમના સગાની ભીડ જોવા મળી હતી. તો હોસ્પિટલની બહાર લારી ગલ્લાનું દબાણ વધારે પ્રમાણમાં હોવાથી ફાયર બ્રિગેડની ગાડી પણ હોસ્પિટલ સુધી લઈ જવામાં સમસ્યા થઈ રહી હતી.

દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટના પગલે હોસ્પિટલમાં ધુમાડો થતા ૨ માળ ખાલી કરવામાં આવ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં વીજપુરવડો ખોરવાયો છે. શારદાબેન હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યા હોવાથી પાર્કિંગમાં ભારે માત્રામાં દર્દી અને તેમના સગાની ભીડ જોવા મળી હતી. તો હોસ્પિટલની બહાર લારી ગલ્લાનું દબાણ વધારે પ્રમાણમાં હોવાથી ફાયર બ્રિગેડની ગાડી પણ હોસ્પિટલ સુધી લઈ જવામાં સમસ્યા થઈ રહી હતી.



શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં રોષ

વલસાડ, તા.૩ | રાજ્યમાં અગાઉ અનેક પેપર લીક થયા બાદ હવે વધુ એક પેપરલીકની ઘટના વલસાડમાં સામે આવી છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શાહ એન.એચ. કોમર્સ કોલેજનું બીકોમ સેમ-પનું એડવાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હતું. તે દિવસે પેપર મોકૂફ રખાયું હતું અને ઓક્ટોબર એટલે કે આજે પેપર લેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં અગાઉ અનેક પેપર લીક થયા બાદ હવે વધુ એક પેપરલીકની ઘટના વલસાડમાં સામે આવી છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શાહ એન.એચ. કોમર્સ કોલેજનું બીકોમ સેમ-પનું એડવાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હતું. તે દિવસે પેપર મોકૂફ રખાયું હતું અને ઓક્ટોબર એટલે કે આજે પેપર લેવાનો નિર્ણય લેવાયો હતો.

સૌરાષ્ટ્રના ખેડૂતોમાં હાહાકાર ગીરસોમનાથમાં અચાનક કપાસના પાકને વ્યાપક નુકસાન થયું હતું

ગીર સોમનાથમાં કપાસની ખેતી કરતા ખેડૂતો રોગચાળાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કપાસમાં આવેલા સુકારા નામના રોગને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ ૧૮ હજાર હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર કર્યું હતું. જો કે સુકારાના રોગને કારણે

ગીર વિસ્તારના ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો છે. સુકારાના રોગને કારણે ખેડૂતોને પ્રતિ વિધા ૧૮થી ૧૯ હજારનું નુકસાન થયું છે. બીજા બાજુ આ રોગને લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કહેવું છે કે વહલી પાકતી જાતોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આગોતરું વાવેતર થવાથી મોટાભાગના કપાસના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અગાઉ ગીર સોમનાથમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હતું. જો કે ગુલાબી ઈયળ સહિતના

રોગોને કારણે કપાસનું વાવેતર ઘટ્યું છે. તેવામાં સુકારાના રોગને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સાથે જિલ્લામાં કપાસનું ઉત્પાદન ખુબ જ ઓછું થાય તેવી શક્યતા છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, કપાસના પાક પાછળ ઘણી મહેનત કરી તેમજ રૂપિયા ખર્ચી પાક તૈયાર કર્યો છે. હવે જ્યારે આ પાકમાંથી પૈસા ઉભા કરવાના સમયમાં આ રોગ આવી જતા અમારી મહેનત અને પૈસા પર આ રોગ ફરી વળ્યો છે. જો કે હાલ આ રોગથી અમે ખેડૂતો મુજવણમાં મુકાયા છીએ.

વિસ્તારમાં ખાણમાં મજૂરી કામ કરવા માટે ખનીજ માફિયાઓ જુલમ ગુજારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા મજૂરોને દોરડાથી બાંધી રાખ્યા હતા અને બળજબરી મજૂરી કામ ખાણમાં કરાવતા હતા. મજૂરો ભાગીને પોલીસ મથકે પહોંચ્યા હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી. મજૂરોની ફરિયાદને પગલે પોલીસે હવે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના થાનગઢ

વિસ્તારમાં કોલસા સહિતની ખાણો આવેલી છે. જ્યાં ખાણમાં મોટા પ્રમાણમાં મજૂરો ખાણનું ખોદકામ કરતા હોય છે. આ દરમિયાન આવી જ રીતે થાનગઢની ખાણમાં મજૂરો પાસે બરજબરી રીતે ખાણનું કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. પોલીસે પણ ખાણમાં રેડ કરી હતી, અને અન્ય બંધક મજૂરોને છોડાવ્યા હતા. ખાણીયા વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.

વિશેષ લેખ

લાલપરી, રાંદરડા તળાવ, કબીર ટેકરીથી ઘેરાયેલ પ્રદ્યુમ્ન પાર્ક ફુદરતી ચટાણ - ઉતરાણ અને પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો રમણીય, સોહામણો અને હરિયાણો વિસ્તાર

રાજકોટ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં ૬૭ પ્રજાતિઓના પપપ પ્રાણી-પક્ષીઓ: દર વર્ષે ૭.૫૦ લાખથી પણ વધુ સહેલાણીઓ લે છે ઝૂની મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ ૬૭ પ્રજાતિઓના પપપ વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝૂની દર વર્ષે ૭.૫૦ લાખથી પણ વધુ સહેલાણીઓ મુલાકાત લે છે. રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પહારતા હોય છે. પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિટેન્ડન્ટ ડો. હિરપરાના જણાવ્યા અનુસાર, એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે રિંછ, મગરો, હરણો, વાંદરા, શ્યાન, અત્યાધુનિક સાપધર અને માછલીધર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. સત્તન ૨૭ પ્રજાતિ ધરાવતા ૧૭૪ પ્રાણીઓની, ૨૬ પ્રજાતિના ૩૩૪ પક્ષીઓ, ૧૪ સરીસૃપ પ્રજાતિના ૪૭ પ્રાણીઓ આ પાર્કમાં વિહરી રહ્યા છે. રાજકોટના તત્કાલીન રાજવી ઠાકોર સાહેબશ્રી પ્રદ્યુમ્નસિંહજીનું નામ આ ઝૂને અપાયુ છે. પ્રદ્યુમ્ન પાર્ક તરીકે જાણીતો આ વિસ્તાર બે બાજુએ લાલપરી, તથા અન્ય બાજુએ રાંદરડા તળાવ તથા કબીર ટેકરીથી ઘેરાયેલ છે. ફુદરતી ચટાણ અને ઉતરાણ અને અનન્ય પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો આ વિસ્તાર ખુબ જ રમણીય, સોહામણો અને હરિયાણો છે. આ પ્રાણી ઉદ્યાન ખાતે એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે પ્રજાતિના રિંછ, બે પ્રજાતિની



મગરો, છ પ્રજાતિના હરણો, ચાર પ્રજાતિના વાંદરા, ચાર પ્રજાતિના શ્યાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. લોકોમાં વન્યસૃષ્ટિ વિશે સમજ અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રાજકોટ પ્રાણી ઉદ્યાન દ્વારા ખુબ જ આકર્ષક સ્ટેટ ઓફ ધ આર્ટ માહિતી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. જે મુલાકાતીઓને ઝૂ વિશે, પ્રાણીઓ વિશે, ગીર અભ્યારણ અને ઘુડખર અભ્યારણ, કચ્છ વિસ્તારના નિવસનંતર વગેરે વિશે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ ઈન્ટરપ્રીટેશન સેન્ટરમાં થીમ આધારીત જુદા

જુદા પ્રદર્શન કક્ષ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રાણી સંગ્રહાલય કક્ષ, ગિર ઈકો સિસ્ટમ, સસ્તન વર્ગનાં પ્રાણીઓ, પક્ષી જગત, સરીસૃપ વર્ગ, કચ્છ ઈકો સિસ્ટમ, એજ્યુકેશન કક્ષનો સમાવેશ થાય છે. ઝૂની મુલાકાત દરમિયાન સહેલાણીઓ આનંદિત રહે તેમજ તેમને દરેક જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી ૧૦ બેટરી સંચાલીત કાર, ૮ ઈંડા પાણીના પરબ, ૮ રેસ્ટીંગ શેડ, ૮ કિડ્સંગણ લોન, ૫ ટોઇલેટ બ્લોકસ, ૪ કેન્ટીન, ૩ બાળ કિડ્સંગણ, ૫ લોન અને ગાર્ડન, મુલાકાતીઓ માટે ૧૦૦ બેન્ચીસ, ૨ વ્હીલ ચેર, ૪ બેબી પ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝૂનામાં ૩ વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે



પ્રવેશ છે. જ્યારે પુષ્પ વયની વ્યક્તિઓ તથા કેમેરા માટે નિયત પ્રવેશ ટિકિટ રાખવામાં આવી છે. બેટરી સંચાલિત વાહન ૩ વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે જ્યારે અન્યો માટે નજીવા દરે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આ પ્રાણીઉદ્યાન દર શુક્રવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૯૮૭માં મોરબીથી એક કાળિયાર હરણની જોડી મેળવી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પાર્ક બનાવી ઝૂની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કમે કમે મગરપાર્ક, માછલીધર, પક્ષીધર તથા પ્રાણીધર બનાવી આજીવન ખાતે ઝૂનો વિકાસ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી, ૧૯૮૨ના



રોજ વિનામૂલ્યે મુલાકાતીઓ માટે ઝૂ વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આજીવન ઝૂ ખાતે વન્યપ્રાણી ધારાધોરણ મુજબ પ્રાણીઉદ્યાનનો વિકાસ શક્ય ન જણાતા પ્રદ્યુમ્ન પાર્ક વિસ્તાર ખાતે ૧૩૭ એકર વિસ્તારમાં ફુદરતી મનોરમ વાતવરણમાં પ્રાણીઉદ્યાન વિકસાવવામાં આવ્યું. અહિં ઝહછ નાં ધારાધોરણ મુજબ જુદા જુદા પ્રાણીઓ માટે વિશાળ કદનાં ખુલ્લાં મોટા પાંજરાઓ બનાવી તા. ૧૪-૦૮-૨૦૧૦ના રોજ તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ તથા પ્રથમ મુલાકાતી તરીકે ટિકીટ મેળવી પ્રવેશ શુલ્કની શરૂઆત કરવામાં આવી હતી.

ચંદ્રને મામા જ તેમ કહેવાય છે, કાકા, માસા કે ફૂઆ કેમ નહીં?



સવાલ ભલે થોડો અળવિતરો લાગે પણ છે એકદમ મુદ્દાનો. અત્યાર સુધી ભલે તમને આ સવાલ ના થયો હોય પણ હવે ચોક્કસ જ વાંચીને તમને પણ ઉત્સુકતા તો થઈ જ હશે ને કે હા રે, ચાંદાને હંમેશા મામા તરીકે જ કેમ સંબોધવામાં આવે છે? કેમ આપણે તેને માસા, કાકા, ભાઈ કે ફૂઆ તરીકે નથી સંબોધતા? થોડા ફલેશબેકમાં જઈએ અને બાળપણમાં જઈએ તો અત્યાર સુધી ચંદ્રને લગતી બધી વાર્તાઓ કે કવિતાઓમાં તેને મામા તરીકે દર્શાવવામાં આવ્યો છે. ચંદામામા દૂર કે હોય કે પછી ચંદામામા કી ભારત હોયપરંતુ શું તમે ક્યારેય તમને સવાલ થયો છે કે શા માટે દરેક વખતે ચંદ્રને મામા જ બનાવવામાં આવે છે. તેને કાકા, માસા કે ફૂઆ કેમ નથી બનાવતા. ચાલો, આજે આપણે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરીશું. ચંદાના મામા બનવા પાછળ કોઈ એક વાર્તા નથી, પરંતુ તેની પાછળ ધાર્મિક, પૌરાણિક અને ભૌગોલિક કારણો પણ જવાબદાર છે. ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ અને વાત કરીએ તો ચંદ્રને મા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે અને આપણે બધા જ મા લક્ષ્મીને માતા માનીએ છીએ એટલે માતાના ભાઈને આપણે મામા કહીને જ બોલાવીએ છીએ ને? હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા કારણ વિશે તો આ કારણ ભૌગોલિક છે. આ ભૌગોલિક કારણ અનુસાર ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ ફરે છે. આ દૃષ્ટિકોણથી ભાઈ અને બહેનના સંબંધને જોઈએ તો ભાઈ પણ તેની બહેનની આગળ પાછળ ફરે છે. ચાંદા મામા બનવા પાછળ માત્ર વાર્તા નહીં પરંતુ ધાર્મિક, પૌરાણિક અને ભૌગોલિક કારણો પણ છે. ધાર્મિક ગ્રંથોમાં ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. આપણે બધા મા લક્ષ્મીને માતા કહીને સંબોધીએ છીએ અને આ સ્થિતિમાં સંબંધને જોઈએ તો ચાંદ સાથેનો આપણો સંબંધ મામા જેવો ગણાય. આ જ કારણથી ચાંદને મામા કહેવાય છે. આવી પરિસ્થિતિમાં ચંદ્રની પૃથ્વીની આસપાસ ફરવાની વૃત્તિ ભાઈ-બહેનના સંબંધ સાથે જોડવામાં આવે છે.

આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવો અને જીવનમાં અકલ્પ્ય પરિવર્તન લાવો

આયુર્વેદ વિશે આખી દુનિયા હવે જાગૃત થઈ રહી છે. આયુર્વેદના મૂળ ભારતમાં હોવા છતાં આપણને આયુર્વેદની પડી નથી, પરંતુ હવે પશ્ચિમ દેશો પણ આયુર્વેદનું મહત્ત્વ સમજતા થયા છે. 'વાયાં ન વળે એ હાયાં વળે' એ કહેવત સાર્થક કરતા હોય એમ ઘણા ભારતીયો પણ હવે આયુર્વેદ તરફ વળી રહ્યા છે. હવે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ તરફ વળવા માટે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. તેઓ કહે છે કે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવવાથી તમારા જીવનમાં શારીરિક, માનસિક અને લાગણીના સ્તરે સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કેટલીક આયુર્વેદિક લાઈફસ્ટાઈલ ચેન્જસ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તમારા ડેઈલી રૂટિનમાં આ આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અમલી બનાવો અને પછી જુઓ ચમત્કાર! નિષ્ણાતો કહે છે કે આયુર્વેદ સ્ટ્રેસને બેલેન્સ કરે છે, મન, શરીર અને સ્પિરિટને બહુ ઊંચા સ્તર પર લઈ જઈ શકે છે. તમારા ડેઈલી રૂટિનમાં અમુક પ્રકારની આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અમલમાં મૂકી તો એ તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે અદ્ભુત પરિણામ લાવી શકે છે એટલે ઘણા લોકો આયુર્વેદિક જીવન પદ્ધતિ તરફ વળી રહ્યા છે. લોકો હવે શારીરિકથી માંડીને માનસિક સમસ્યાઓ કે ચામડી અથવા દાંતની સમસ્યા માટે પણ આયુર્વેદનો સહારો લેતા થઈ ગયા છે. નિષ્ણાતો કહે છે કે સૌ પ્રથમ તો સ્ટ્રેસને મેનેજ કરતાં શીખો. સ્ટ્રેસને કારણે પણ તમારી તંદુરસ્તી



પર ખૂબ ઊંડી અસર થઈ શકે છે. આયુર્વેદ પ્રાણાયામ અને ધ્યાન પર ભાર મૂકે છે. પ્રાણાયામ અને ધ્યાન થકી તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો અને રિલેક્સ થઈ શકો છો. ડીપ બ્રિથિંગ અને માર્ઈન્ડુલનેસ મેડિટેશન પણ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, મનને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે છે, તંદુરસ્તી પણ વધારી શકે છે. આયુર્વેદ કહે છે કે તંદુરસ્તી માટે ઈમોશનલ વેલ-બીઈંગ (એટલે કે લાગણીના સ્તરે ફીટ રહેવું) જરૂરી છે. તમને ગમતી વ્યક્તિઓ સાથે સમય પસાર કરો. એવી પ્રવૃત્તિઓ કરો જે તમને આનંદ આપે. પોતાની જાતની સંભાળ લેતા શીખો, પોતાની જાતને પ્રેમ કરતા શીખો. તંદુરસ્ત સંબંધો તમને ઈમોશનલ, મેન્ટલ ફિટ રાખી શકે છે અને ઈમોશનલ વેલ બીઈંગને પણ વધુ મજબૂત કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે તમે દિનચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ડેઈલી રૂટિન(રોજિંદા જીવનમાં)માં દરેક પ્રવૃત્તિ માટે નિશ્ચયિત સમય રાખો. સવારે વહેલા ઊઠો, મેડિટેશન કરો, નિયમિત સમય પર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લો.

ડેઈલી રૂટિનમાં અમુક પ્રકારના ફેરફાર કરીને તમે તમારા શરીરની ઈન્ટર્નલ કલોકને ઈમ્યૂવ કરી શકો છો જે તમારા જીવનમાં ઓવરઓલ અકલ્પ્ય અને પોઝિટિવ ચેન્જ લાવી શકશે. આ સિવાય એ પણ મહત્ત્વનું છે કે તમે બેલેન્સ ડાયેટ એટલે કે સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો. આયુર્વેદ એ વાત પર ભાર મૂકે છે કે તમારા ખોરાકની ક્વોલિટી અને કોલ્ટિટી (ગુણવત્તા અને માત્રા) પર ધ્યાન આપો. ફેશ, સિઝનલ અને સ્થાનિક વિસ્તારમાં ઉત્પાદન થતું હોય એવો ખોરાક ખાવાનું પસંદ કરો. એવો ખોરાક તમારા શરીર માટે વધુ યોગ્ય રહેશે. પ્રોસેસ ફૂડ્સ, વધારે પડતી ખાંડ અને ભારે - ચીકણા ખોરાકને તિલાંજલિ આપી દો. સંતુલિત આહાર તમારા શરીરમાં સકારાત્મક પરિણામ લાવી શકશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધુ સક્ષમ બનાવી શકશે. આયુર્વેદિક લાઈફસ્ટાઈલમાં માર્ઈન્ડુલ ઈટિંગ પણ અપનાવો. આયુર્વેદમાં માર્ઈન્ડુલ ઈટિંગ પર ભાર મુકાયો છે (માર્ઈન્ડુલ ઈટિંગ એટલે કે તમે ખાતી વખતે સંપૂર્ણપણે ખાવા પર જ ધ્યાન આપો). તમે જે ભોજન લો તે ખૂબ યાવનીને ખાઓ. ધીમેથી ખાઓ. તમારા શરીરની ભૂખ પ્રમાણે જ ભોજન લો. માર્ઈન્ડુલ ઈટિંગ તમને ઓવર ઈટિંગ (વધુ પડતું ખાવાથી) પણ બચાવશે. આયુર્વેદ ઊંઘ પર પણ ખૂબ ભાર મૂકે છે. દરેક માણસ માટે સારી અને પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે ઊંઘવું એ તંદુરસ્તી જાળવવા માટે બહુ મહત્ત્વનું છે.

મહિલાઓ આ રીતે પોતાના ફિગરને મેઈન્ટેન કરી શકશે



મસલ્સ ગેન કરવા માટે પ્રોટીન ઈનટેક વધારવું ખૂબ જ જરૂરી છે. પ્રોટીન સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ખાસ કરીને માંસપેશિઓનો વિકાસ કરવામાં પ્રોટીન સહાયક હોય છે. એટલા માટે જો આપના સ્તનની મસલ્સ ઝોથ નથી થયો તો, આપનું પ્રોટીન ઈનટેક વધારી લેવું જોઈએ. પ્રોટીન ઈનટેક વધારવાથી આપના સ્તન મસલ્સ ગેન થશે અને બ્રેસ્ટ સાઈઝ પણ વધવા લાગશે. તેના માટે આપ દૂધ, દહીં, પનીર, ઈડા, નોનવેજ વગેરે પોતાની ડાયેટમાં સામેલ કરી શકશો. રોજ પ્રોટીન લેવાથી આપના બ્રેસ્ટનો આકાર વધારવામાં ખૂબ જ મદદ મળી શકે છે. જો તમે પણ સ્તનની સાઈઝ સારી રીતે નથી વધારી શકતા તો, આપ બ્રેસ્ટના આકાર માટે અમુક રીત અપનાવી શકો છો. તો આવો બ્રેસ્ટના આકાર વધારવા માટે સરળ રીત કઈ કઈ હોય શકે છે, બ્રેસ્ટનો આકાર કઈ રીતે વધારવો, તેના ઘરેલુ ઉપાય જણાવીએ. રેગ્યુલર એક્સરસાઈઝ કરો, બ્રેસ્ટનો આકાર વધારવા માટે નિયમિત રીતે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. એક્સરસાઈઝ મસલ્સ ગેન કરવામાં મદદ કરી શકે છે. એટલા માટે જો આપના સ્તનનો વિકાસ ઠીક રીતે ન થતો તો આપ રેગ્યુલર એક્સરસાઈઝની પ્રેક્ટિસ કરી શકે છે. આપના સ્તનનો આકાર વધારવા માટે પુશ-અપ્સ, ચેસ્ટ પ્રેસ એક્સરસાઈઝ, કોબરા પોઝ અથવા વોલ પ્રેસ એક્સરસાઈઝ કરી શકે છે. રોજ અડધોથી એક કલાક આ એક્સરસાઈઝને કરવાથી આપના બ્રેસ્ટની સાઈઝ વધારવામાં ઘણા બધાં અંશે મદદ મળી શકે છે. જો આપ આપના બ્રેસ્ટની સાઈઝ વધારવા માગો છો તો તમારે નિયમિત રીતે સ્તનની માલિશ કરવી જોઈએ. બ્રેસ્ટ મસાજ કરવાથી સ્તનની માંસપેશિઓમાં રક્ત પ્રવાહ સારો રહેશે. તેનાથી સ્તનના મસલ્સ ગેન થાય છે અને ધીમે ધીમે સાઈઝ વધવા લાગે છે. બ્રેસ્ટનો આકાર વધારવા માટે આપ સરસવનું તેલ, નારિયળ તેલ, ઓલિવ ઓઇલ, કેસ્ટર ઓઇલ વગેરે મસાજ કરી શકે છે. તેના માટે આપ પહેલા ઓઇલને થોડું ગરમ કરો, હવે આ ઓઇલને હાથ પર લઈને સ્તનના સર્ક્યુલેશનમાં મોશનથી મસાજ કરો. બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે આપ સવાર-સાંજ સ્તનની મસાજ કરી શકો છો. બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે આપ એસ્ટ્રોજન રિચ ફૂડ્સનું સેવન કરો. હકીકતમાં જોઈએ તો, જેમ જેમ એસ્ટ્રોજન પ્રોજેસ્ટરનો હોર્મોનનું સ્તર વધે છે, મહિલાઓમાં યૌવનની સ્થિતિ આવે છે, અને તેમના સ્તનનો વિકાસ પણ થાય છે. પણ અમુક મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર કમ થાય છે.

રિપોર્ટ અનુસાર પગ ધોઈને સુવાથી સ્વાસ્થ્યને ગજબના ફાયદા

જો તમે અત્યાર સુધી દિવસભરના કામકાજ બાદ પગ ધોયા વગર બેડ પર સુવા પહોંચી જાવ છો તો તમારે તમારી આ આદતને તકાલ બદલવાની જરૂર છે. આમ કરવાથી તમે અજાણતા તે હેલ્થ બેનિફિટ્સને મુદતથી દૂર કરી રહ્યાં છો જે રાત્રે પગ ધોઈને સુવાથી મળે છે. તમને ખ્યાલ નહીં હોય કે પગ ધોઈને સુવા માત્ર હાઈજીન નથી પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. તેવામાં આજે અમે તમને રાત્રે પગ ધોઈને સુવાથી મળતા ફાયદા વિશે જણાવીશું. વ્યક્તિના શરીરનું સમગ્ર વજન તેના પગ દ્વારા દિવસ દરમિયાન વહન કરવામાં આવે છે. જેના કારણે પગમાં જકડાઈ જવા કે ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા પગ ધોયા પછી જ સૂઈ જાઓ. આમ



કરવાથી માત્ર પગની માંસપેશીઓ જ નહીં પરંતુ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. સ્લીપ ડેટ કોમમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર જે લોકોને પગમાં વધુ પરસેવાની સમસ્યા રહે છે, જેને હાઈપરહાઈડ્રોસિસ પણ કહેવામાં આવે છે, તેણે રાત્રે પગ ધોયા વગર સુવું જોઈએ નહીં. પગને ધોઈને સુવાથી બેક્ટેરિયાનો વિકાસ થતો નથી, જેનાથી અંધલીટ

કુટની સમસ્યાને ઘટાડવામાં મદદ મળે છે. આખો દિવસ દોડવાથી પગના સ્નાયુઓ અને હાડકાંમાં દુખાવો થાય છે, તેમજ સ્નાયુઓમાં તણાવ રહે છે. રાત્રે પગ ધોયા પછી સુવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને તે હળવાશ પણ અનુભવે છે. આયુર્વેદમાં પણ રાત્રે સૂતા પહેલા પગ ધોવાની સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી ન માત્ર સારી ઊંઘ આવે છે પરંતુ વ્યક્તિ તણાવમુક્ત પણ અનુભવે છે. જે લોકોને રાત્રે વધુ ગરમી લાગે છે તેણે પણ રાત્રે પગ ધોઈને સુવું જોઈએ. રાત્રે સૂતા પહેલા પગ ધોવાથી શરીરનું તાપમાન સામાન્ય બનેલું રહે છે. દિવસભર મોજા પહેરવાથી પગમાં ઢુગંધ આવવા લાગે છે. જેનાથી છુટકારો મેળવવા માટે પગને જરૂર ધોવા જોઈએ. આમ કરવાથી ન માત્ર પગમાં હવા લાગે છે.

BOLLYWOOD NEWS FLASH

પાકિસ્તાન પર ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક, અક્ષય કુમારે ફિલ્મની કરી જાહેરાત



પાકિસ્તાન પર ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક, અક્ષય કુમારે ફિલ્મની કરી જાહેરાત

ટીઝરને શેર કરતા ફિલ્મ અભિનેત્રી કંગના રનોતે લખ્યું કે, હું દેશના પ્રેમ માટે ઉડાન ભરવા માટે તૈયાર છું

કંગના રનોત 'તેજસ'માં ફાઈટરના લુકમાં જોવા મળી છે



કંગના રનોતે 'તેજસ'માં ફાઈટરના લુકમાં જોવા મળી છે. તેણે પાત્ર ખૂબ જ મજબૂત લાગે છે. કંગનાની આગામી ફિલ્મનું ટીઝર ન માત્ર પાવરફુલ લાગી રહ્યું છે તેમાં શાનદાર ડાયલોગ પણ છે. તે કહે છે, "જો તમે ભારતને ચીડવશો તો છોડીશું નહીં." ટીઝર રિલીઝ થવાની સાથે જ અભિનેત્રીએ ટ્રેલરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મનું ટ્રેલર ૮ ઓક્ટોબરે એરફોર્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવશે. ટીઝર શરૂ થાય છે અને કંગનાનો દમદાર ડાયલોગ સંભળાય છે. હવે યુદ્ધના મેદાનમાં યુદ્ધ થવું જોઈએ, હવે આકાશમાંથી વરસાદ નહિ આગ વરસવી જોઈએ." આ ડાયલોગ પછી કંગના જોરદાર સ્ટાઈલમાં એન્ટ્રી

સ્વરા ભાસ્કર પતિ અને લાડલી સાથે છઠ્ઠીનો વીડિયો કર્યો શેર

સ્વરા ભાસ્કરે તાજેતરમાં દીકરી રાખિયાની છઠ્ઠી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સ્વરાએ તેમના ઘરે ગેટ ટુ ગેથરનું આયોજન કર્યું હતું. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ પ્રસંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રખ્યાત લોકગીત ગાતી જોવા મળી રહ્યા છે. સોમવારે આ ખાસ પ્રસંગનો વીડિયો શેર કરતી વખતે સ્વરાએ ખૂબ જ ભાણુક કેપ્શન શેર લખ્યું હતું. એક્ટ્રેસે લખ્યું - 'અમારા લગ્ન પછીથી અમે અમારી વચ્ચે સમાન પ્રથા શોધી રહ્યા છીએ, જે ઉત્તર ભારતમાં હિંદુ અને મુસ્લિમ બંને શેર કરે છે. આ મારી માન્યતાને મજબૂત કરે છે કે ભલે દુનિયામાં વિવિધ પ્રકારના લોકો રહે છે, પ્રેમ અને ખુશી એક સામાન્ય ભાષા શોધે છે. સ્વરાએ વધુમાં લખ્યું - 'છઠ્ઠી અથવા બાળકના જન્મનો છઠ્ઠો દિવસ સમગ્ર યુપી બિહારમાં ઉજવવામાં આવે છે, જ્યાં માતા અને બાળકને પીળાના રંગના કપડાં પહેરાવવામાં આવે છે અને માસી અથવા ફોઈ બાળક, તેની માતા અને પિતાને કાજલ લગાવે છે. જેથી બાળકો અને પરિવારને ખરાબ નજરથી બચાવી શકાય. વીડિયોમાં ગાયેલા લોક ગીત વિશે વાત કરતાં સ્વરાએ લખ્યું - હું એક લોકપ્રિય સોહર ગાઈ રહી છું, જે મોટાભાગે છોકરાના જન્મની ઉજવણી માટે ગવાય છે, પરંતુ મેં તેમને મારી દીકરી માટે તૈયાર કર્યું છે. જો કે સોહર બાળકની માતા દ્વારા ગાયું નથી, તે બહેનો અને પરિવારની અન્ય મહિલાઓ દ્વારા ગાયું છે. પણ ઢોલક જોયા પછી મને લાગ્યું કે આ લોકગીત ગાયું જોઈએ. સ્વરા તથા ફહાદે દે જાન્યુઆરી, ૨૦૨૩ના સોશિયલ મેરેજ એક્ટ ડેઠળ ડોક્યુમેન્ટ્રીસ સંબંધિત કર્યા હતા. ૮ જાન્યુઆરીએ સ્વરાએ એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સ્વરાએ પોતાનું માથું મિસ્ટ્રી મેનના હાથ પર મૂક્યું હતું અને બંને પલંગ પર હતાં. જોકે, તસવીરમાં કોઈનો યહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નહોતો. સ્વરાએ તસવીર શેર કરીને કહ્યું હતું કે આ કદાચ પ્રેમ હોઈ શકે છે. હિમાંશુ શર્મા સાથે સંબંધો હતા. સ્વરા બોલિવૂડ રાઈટર હિમાંશુ શર્માને ડેટ કરતી હતી. જોકે, ૨૦૧૯માં બંને અલગ થઈ ગયાં હતાં. હિમાંશુએ ૨૦૨૧માં રાઈટર કનિકા વિલ્લોન સાથે લગ્ન કર્યા હતાં. કોણ છે, ફહાદ અહમદ?



પ્રિયંકા ચોપરાને સ્ક્રિપ્ટ પસંદ ન પડતાં ફિલ્મ "જુ લે જરા" અટકી પડી છે

પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરિના કેફની ફિલ્મ 'જુ લે જરા' આ ત્રણેય હિરોઈનોની તારીખોની સમસ્યાને કારણે અટકી પડી હોવાનું બહાનું અગાઉ સર્જક ફરહાન અખ્તરે ઉચ્ચાર્યું હતું. પરંતુ, હવે એવું બહાર આવ્યું છે કે વાસ્તવમાં પ્રિયંકાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ જ પસંદ ન પડી હોવાથી ફિલ્મ અટકી પડી છે. પ્રિયંકા તેની કઝિન પરિશિતી ચોપરાના લગ્ન વખતે ભારત આવશે અને ત્યારે આ ફિલ્મ ઓપથારિક રીતે સાઈટન કરશે તેવું આયોજન ગોઠવાયું હતું. પરંતુ, પ્રિયંકાએ ફિલ્મની સ્ક્રિપ્ટ નકારી કાઢી હતી. આથી, ફિલ્મ

અટકી ગઈ છે તેવું ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે. એક દાવા અનુસાર આ ફિલ્મ આશરે બે વર્ષથી પાઈપલાઈનમાં છે પરંતુ હવે જે રીતે તેનું ઓરિજનલ કાસ્ટિંગ છિત્રભિત્ર થઈ ચૂક્યું છે તે જોતાં બહુ નજીકના ભવિષ્યમાં આ પ્રોજેક્ટ આગળ વધશે કે કેમ તે નક્કી નથી. ફરહાનની બહેન જોયા અખ્તર એવો દાવો કરી ચૂકી છે કે આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવાયો નથી પરંતુ તે તેના સમયે આગળ વધશે. બીજી તરફ ફરહાન એવું કહીને હાર કબૂલી ચૂક્યો છે કે દરેક ફિલ્મ પોતાનું નસીબ લઈને આવતી હોય છે અને આ ફિલ્મ માટે કાંઈક જુદું જ નસીબ લખાયેલું છે.



સાગબારા ખાતે શિક્ષકોની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. કેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે થઈ હતી મારામારી

। દીપક જગતપ રાજપીપળા, તા.૩ ।
નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. કેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે ઘટના બનાવની મારામારીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ નિયામકને સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધલઈ સમગ્ર ઘટના અંગે પ્રકરણના તપાસના આદેશો કરી દેતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રો પાસેથી મળેલી હકીકત અનુસાર શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યાં છે. હું ગુરુજનોનો આદર કરું છું. પણ શિક્ષકો આવી જાહેરમાં મારામારી કરે એ શિક્ષક માટે શિક્ષણ જગતમાટે શરમજનકવાત કહેવાય. એને સાંખી નહીં લેવાય. હું અંગે ઘટનાની તપાસ કરી



રિપોર્ટ કરી કાર્યવાહી કરવા પણ જણાવી દીધું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સાધારણ સભામાં વાર્ષિક હિસાબોની વાતો આવતા થઈ બોલાચાલી થઈ હતી એમાંથી વાત વણસી હતી. પૂર્વ પ્રમુખ પાસે હિસાબો માંગો તેવી વાત એક શિક્ષકે કહ્યો તો મહિલા શિક્ષકે ચાલુ સભામાં લાફો મારી દીધો હતો. અને મહિલા શિક્ષકે અપશબ્દો બોલી મારામારી કરતા તેમના પતિ એ પણ કહ્યું હુમલો કર્યો હતો. શિક્ષક દ્વારા કરાયેલી મારમારી માં બે શિક્ષકો ઘાયલ થયા હતાં. અને હુમલો કરનારા ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ માં ગુનો નોંધાયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું હવે શનિવાર અને રવિવારે એસઆરપીનું પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે



। રાજપીપળા, તા.૩ ।
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે અવનવા આકર્ષણો હાલ ઉપલબ્ધ છે. પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે, હવે અહીં આવતા પ્રવાસીઓ શનિવાર અને રવિવારે સાંજના સમયે, એસઆરપી પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ માણી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આજે વૈશ્વિક

દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી દાહોદ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત સામે આવી

। દાહોદ, તા.૩ ।
દાહોદ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત સામે આવી છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તે દર્દીઓ ઉભા ઉભા હાથમાં બોટલ પકડીને સારવાર લેતા નજરે પડ્યાં હતા. આરોગ્ય કેન્દ્રમાં એક પથારી પર બે દર્દી જોવા મળ્યા. જેને લઈ તંત્ર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

બેદરકારીથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલી આરોગ્ય કેન્દ્રની હાલત એવી કફોડી છે કે અહીં દર્દીઓની સારવાર માટે જગ્યા જ નથી.
આરોગ્ય કેન્દ્રમાં એક પથારી પર બે દર્દીઓ જોવા મળી રહ્યા છે. તે દર્દીઓ ઉભા ઉભા હાથમાં બોટલા પકડીને સારવાર લેતા નજરે પડી રહ્યા છે. જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. શહેરી જનોને આરોગ્યની સુવિધા પૂરી પાડવી એ તંત્રની પ્રાથમિક ફરજ છે પરંતુ અહીં સ્થિતિ કઈ અલગ જોવા મળી રહી છે.

વડગામ તાલુકાના શેરપુરાની ઘટના બનાસકાંઠા જિલ્લાના શેરપુરા ગામે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી

। બનાસકાંઠા, તા.૩ ।
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે પતિએ તકરારમાં પત્નીની હત્યા કરી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતાના પુત્ર સમક્ષ કહ્યું કે, મેં તારી માતાને પતાવી દીધી છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય તકરાર થયા બાદ ગુસ્સે થયેલા પતિએ કુહાડીના ધા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.



આ ઘટનામાં પોલીસે પતિની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર વડગામ તાલુકાના શેરપુરા ગામે નવાહા ઠાકોર અને તેમના પત્ની કુંવરબેન રહેતા હતા. બંનેને ત્રણ સંતાન છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે. આ પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે વિવાદ થતો હતો. આ પહેલા પણ પતિ-પત્ની વચ્ચે તકરાર થી યુકી છે. ત્યારબાદ કુંવરબેન તેના પિયરે જતા રહ્યાં હતા. આ ઘટના બાદ નવાહા ઠાકોરના પરિવારજનો કુંવરબેનને પરત લાવ્યા હતા. આ ઘટના બાદ ગઈકાલે સાંજના સમયે બંને પતિ-પત્ની ખેતરમાં ગયા હશે. ત્યાં ફરી કોઈ મુદ્દે બબલા થી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ધા માર્યા હતા. કુહાડીના ધા લાગ્યા બાદ કુંવરબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર

હોરા ધર્મગુરુ સૈયદના સાહેબ ૬ ઓક્ટોબરથી સૌરાષ્ટ્રના ૧૬ ગામનો ૧૩ દિવસનો પ્રવાસ કરશે

। હુસામુદ્દીન કપાસી જસદણ, તા.૩ ।
વિશ્વભરના દાઉદી હોરા સમાજના ત્રેપનમાં દાઉદી (સર્વોચ્ચ ધર્મગુરુ) તાજદાર સૈયદના અબુ જાફર સુલતાન આલીકદર મુકદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આગામી તા. ૬ ઓક્ટોબર ૨૦૨૩ ને શુક્રવારના રોજ જામનગર પધરામણી કરી સળગ ૧૩ દીવસમાં ૧૬ ગામનો પ્રવાસ કરી પોતાના હજારો અનુયાયીઓને મળશે.
આ અંગે ગામે ગામ તડામાર તૈયારીઓ થઈ રહી છે હજારો પરિવારોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા પ્રખર માનવતાવાદી નામદાર ડો. સૈયદના સાહેબ ઘણાં વર્ષો પછી સૌરાષ્ટ્રના જામનગર, જામખંભાળિયા, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, વિસાવદર, મીઠાપુર, બગસરા, ધારી, ચલાળા, જસદણ, ગોંડલ થઈને રાજકોટ પાંચ દિવસનું રોકાણ કરશે આ દરમિયાન ખાસ કરીને રાજકોટ ખાતેના તેમના ધર્મપ્રવચનનો બહોળી સંખ્યામાં ભાગ લઈ એવી આયોજકોની ધારણાં છે દરમિયાન



નામદાર ડો. સૈયદના સાહેબની હાજરીમાં નિકાહ, નમાજ, મિસાક, જીયારત, જીયાકંત, વાએઝ, કદમબોસી, પગલાં, શેહરા જેવાં અનેક ધાર્મિક સહિતના કાર્યક્રમો પણ થશે વર્ષો પછી સૌરાષ્ટ્રના પ્રવાસે આવતાં સૈયદના સાહેબના દીદાર કરવા અંગે ગામેગામ રીતસરની પડાપડી થશે આ માટે આયોજકોએ કોઈને અગવડતા ન પડે તે માટે તૈયારીને આખરી ઓપ આપી દીધી છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કસ્તૂરબાધામ, ત્રંબા ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું



। રાજકોટ, તા.૩ ।
રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તૂરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, મંત્રીશ્રીએ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને જીવી લીધો છે. સ્વચ્છતા, ખાદી, ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છતા સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂજ્ય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુ:ખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની હડત જોડાયેલી છે તે કસ્તૂરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી. આ પ્રસંગે કસ્તૂરબાધામ ખાતે મંત્રીશ્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કસ્તૂરબા નિવાસની સુવિકાસ તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રદર્શનનો મધ્યવર્તી વિચાર - સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના

૧૦૦૦ બાળકો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે સ્વાસ્થ્ય, પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી, કૃષિ, પ્રત્યાયન, વાહન વ્યવહાર જેવા વિષયો પર પાંચસો જેટલી કૃતિઓ રજૂ કરાશે

। અમદાવાદ, તા.૩ ।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન”નું આયોજન તારીખ ૪ ઓક્ટોબર, બુધવારના રોજ અમદાવાદના પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દરેક શાળામાંથી એક શિક્ષક અને એક વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે તેમજ ધોરણ ૬ થી ૮ના ૧૦૦૦ બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ રજૂ કરશે. પ્રદર્શનનો મધ્યવર્તી વિચાર “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” રાખવામાં આવ્યો છે. આ મુખ્ય વિષય હેઠળ સ્વાસ્થ્ય, પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી, કૃષિ, પ્રત્યાયન, વાહન વ્યવહાર સહિતના વિષયોને આવરી લેતી કૃતિઓ દર્શાવવામાં આવશે. આ પ્રદર્શનમાં

પહેલા પાંચ સ્થાને આવનારા બાળવૈજ્ઞાનિકોને રાજ્ય સ્તરના આયોજિત થનાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મોકલાશે. સાથોસાથ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જીસીઈઆરટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું આ સંયુક્ત આયોજન છે. જેનું ઉદ્દેશ્યતન મેયર શ્રીમતી પ્રતિભા જેનના હસ્તે થશે જ્યારે કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત તરીકે ઓડા પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર શાહ તેમજ અન્ય આમંત્રિતોમાં ડે. મેયર શ્રી જીતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, મનપાના શાસક પક્ષના નેતા શ્રી ગોરંગ પ્રજાપતિ, મનપાના શાસક પક્ષના દંડક શ્રીમતી શીતલબેન ડાગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ, લ, ઇ) :
આજના દિવસે બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ આપાવશે. આજે પૈસા અંગે પ રિચાર ના સભ્યો માં બોલાચાલી થઈ શકે છે.

વૃષભ (બ, વ, ઉ) :
આજના દિવસે તમારું શારીરિક સામંથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો.

મિથુન (ક, ઇ, ઘ) :
આજના દિવસે તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજે તમારે તમારા તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું? કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે.

તુલા (ર, ત) :
આજના દિવસે એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે.

કર્ક (સ, ડ) :
આજના દિવસે ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિમતી સમાન નું ધ્યાન રાખો કેમકે સમાન ચોરી થવા ની શક્યતા છે. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. આંખો કઠી જુદું બોલીતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે.

સિંહ (મ, ટ) :
આજના દિવસે તમારું વ્યક્તિત્વ આજે અતરની જેવું કામ કરશે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો? કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે.

કન્યા (પ, ઠ, ડા) :
આજના દિવસે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. આજે તમારે તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું? મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદભુત બની જશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે.

મકર (બ, જ) :
આજના દિવસે લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. આજે તમને સમજ પડી શકે છે કે સમજળા વિચાર્યાં વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. અન્યોની દખલ ધરણ પેદા કરશે.

કુંભ (ગ, શ, સ) :
આજના દિવસે મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે ઈચ્છિત થશો. પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નમિત્ર ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે.

વૃશ્ચિક (ન, ય) :
આજના દિવસે તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. મોટી પહેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યા દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે-તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડીફલોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે.

ધન (ભ, ઇ, ફ) :
આજના દિવસે બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાજા ભાગવાવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. ધંધામાં ઉકાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો.

મીન (દ, ઝ, ઞ, થ) :
આજના દિવસે તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજું કરવા તેનો ઉપયોગ કરો. જમીન અથવા કોઈ મિલકત માં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓ માં નિવેશ કરવા લી બન્યો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ.



ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી



। દીપક જગતાપ રાજપીપળા, તા.૩ । પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆત થી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી હતી, આ રોમાંચક સફરે અખબારો અને ટી.વી ચેનલ્સની હેડલાઈન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફર દરમિયાન તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.



નવરાત્રિમાં વિવિધ પ્રકારના ઘરેણા પહેરવા માટે માલેકચોકમાં ઘરેણાની ખરીદી કરાવવા ઉમટી પડેલ લોકો.

ઘાટલોડિયાની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ આવી વિવાદમાં ફ્યુચર સ્કૂલના બાળકોને નમાજ પઢાવવામાં આવતા વિવાદ સર્જાયો સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો લાલદુમ થઈ ગયા છે

। અમદાવાદ, તા.૩ । અમદાવાદની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો લાલદુમ થઈ ગયા છે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો સ્કૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી પોંખ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. છઠ્ઠાંના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ શિક્ષકને ક્લાસરૂમની બહાર



દ્વારા ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલના પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરાઈ રહી છે. પ્રિન્સિપાલના રાજીનામાની માંગ પર ABVP વિદ્યાર્થી પોંખ અડગ છે. તો પોલીસની ટીમ પણ સ્કૂલ ખાતે દોડી આવી છે. પોલીસ દ્વારા હિન્દુ સંગઠનો અને ABVPના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ વાલીઓ પણ સ્કૂલ ખાતે પહોંચી ગયા છે. વાલીઓ દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કામ ન કરતા અધિકારીઓને તગેડી મૂકશે રાજ્ય સરકાર

। ગાંધીનગર, તા.૩ । સરકારી ઓફિસોમાં કામ નથી તેવી ફરિયાદો આજકાલની નથી, જૂની છે. લોકોના કામની ફાઈલો વધતી જાય છે, છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી ઢાલતું નથી. આવામાં હવે સરકાર આવા સરકારી બાબુઓ પર લગામ લગાવવાનું વિચારી રહી છે. ગુજરાતના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ-૧ અને ક્લાસ-૨ ના ૫૫ વર્ષથી ઉપરના નિષ્ક્રીય અધિકારીઓની હકાલ પટ્ટી કરાશે. તેઓને જલ્દી જ નોકરીમાંથી કાઢી મૂકવાનો તમો તૈયાર કરાશે. આ માટે સામાન્ય વિભાગ દ્વારા ૨૯ સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના બહાર આવતા જ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારે નક્કી કર્યું છેકે, ૫૦ થી ૫૫ વર્ષની વયે આવા અધિકારીઓને સેવા નિવૃત્ત કરવાની સત્તા મળી છે. તેથી અગાઉની સૂચના ૨૬ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને ૫૦-૫૫ વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે તેવી સત્તા સરકાર પાસે છે.

પ ઓક્ટોબર સુધી હડતાળ અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા, લાખો મુસાફરો અટવાશે ઓનલાઈન એપથી ટુ વ્હીલર મુસાફરીનો કેન્દ્ર વધતા રોજુ પર અસર પડી : રીક્ષાચાલકોની ભૂખ હડતાળની પણ ચીમકી

। અમદાવાદ, તા.૩ । અમદાવાદમાં રીક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની ઢાલવ આજથી ત્રણ દિવસ માટે કફોડી બનવાની છે. કારણ કે, અમદાવાદના રીક્ષાચાલકો આજથી ત્રણ દિવસ હડતાળ પર ઉતર્યા છે. શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપ થી ટુ-વ્હીલરની મુસાફરી વધતા રીક્ષાચાલકો રોષે ભરાયા છે. તેમની આવક પર અસર થઈ રહી છે. સરકારે રીક્ષાચાલકો આજથી ત્રણ દિવસ રીક્ષા નહિ દોડાવે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન આજથી ત્રણ દિવસ એટલે કે ૩ ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. સાથે જ યુનિયન દ્વારા ચીમકી અપાઈ કે જો તેમની માંગ પૂરી કરવામાં નહિ આવે તો રીક્ષાચાલકો ભૂખ હડતાળ પર પણ ઉતરી શકે છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર પર મુસાફરી અમદાવાદ શહેરમાં વધી રહી છે. જે ગેરકાયદેસર હોવાથી અમે ઘણીવાર સરકારને આને બંધ કરાવવા અમારી રજૂઆત છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.



નરોડાના યુવકે ખોટું બોલીને નિકોલની યુવતીને ફસાવી ડોક્ટરની ઓળખ આપી લગ્ન કરનારા યુવકનો રિસેપ્શનમાં જ ભાંડો ફૂટ્યા

। અમદાવાદ, તા.૩ । નિકોલમાં રહેતી સ્વરૂપવાન યુવતીને નરોડાના યુવકે ખોટું બોલીને લગ્નજાળમાં ફસાવી છે. કોલેજમાં ભણતી ૨૨ વર્ષીય યુવતીને યુવકે પહેલા પ્રેમ સંબંધમાં રાખી અને પોતે ડોક્ટર તથા કરોડો રૂપિયાની મિલકત શેર બજારમાંથી કમાય છે તેવું કહ્યું હતું. જોકે ત્યારપછી એક મહિલા મિત્રની મદદથી આ યુવકે જબરી ગેમ રમી યુવતીને ફસાવી દીધી હતી. વર્ષો સુધીના રિલેશનશિપ માં યુવકે જરાય પણ ભનક પણ નહોતી લાગવા દીધી કે તે મિલકત ક્યાં પરિવારનો છે અને ડોક્ટર પણ નથી. જોકે રિસેપ્શન સમયે તેનો ભાંડો ફૂટના જબરો દાવ થયો હતો. આ યુવક નરોડામાં જ રહેતો હતો અને તેને કોઈ હોવાથી લગ્ન નહોતા થઈ રહ્યા. તેવામાં એક

કોલેજ બહાર તે રોજ ચા પીવા માટે જતો હતો. આ સમયે કોલેજની સૌથી સુંદર છોકરી કહી શકો એવી આ યુવતી પણ ત્યાં આવતી હતી. ઘણા બધા છોકરાઓ તેની સાથે મિત્રતા કરવા માટે પ્રયાસ કરતા હતા. જોકે યુવકે અલગ દિમાગ દોડાવ્યું અને પોતાની મહિલા મિત્ર થકી ડાયરેક્ટ લગ્ન માટે પૂછાડવડાવ્યું હતું. યુવકે રોજ ચા પીવા જાય ત્યારે તેની નજર યુવતી સાથે મેળ ખાતી હતી. આ સમયે પોતાના મિત્રની સ્પોર્ટ્સ બાઈક અને કાર લઈને તે રોજ જતો. અઠવાડિયે એકવાર તે ગાડી કે બાઈક બદલતા યુવતીને થયું કે આ ઘણો અમીર હશે. વળી તેની મહિલા મિત્ર દ્વારા યુવકે તેને પૂછાડવડાવ્યું કે શું તે લગ્ન કરશે. મહિલા મિત્રએ આ યુવતીને કહ્યું કે મારો મિત્ર ઘણો અમીર છે, તે પોતે આંખનો ડોક્ટર

છે પરંતુ શરીર પર સફેદ ડાઘ હોવાથી તેની સાથે કોઈ લગ્ન નથી કરી રહ્યું. તુ એક વાર કોફી ડેટ પર તો જા આ યુવક સાથે. જોકે આ સમયે યુવતીએ ના પાડી દીધી અને જતી રહી હતી. કોલેજ બહાર યુવકને દરરોજ જોતા યુવતીને થયું કે લાવ એકવાર મિત્રતા તો કરી લઉં. તે સમયે યુવક અને યુવતી વચ્ચે મિત્રતા થઈ અને બંને એક કેફેમાં મળ્યા હતા. જ્યાં યુવકે તેને ખોટું ખોટું કહેવાનું ચાલુ કરી દીધું હતું. તેણે કહ્યું કે હું પોતે આંખનો ડોક્ટર છું, મારી પાસે અઠગન રૂપિયા છે તથા મારા પિતા એસટીનિગમમાં મોટી પોસ્ટ પર છે. અમારે ઘરમાં રૂપિયાની જરાય અછત નથી. શેર બજારમાં મારી ઈકમ જાણીને તને ચક્કર આવી જશે એટલો કરોડોમાં પ્રોફિટ છે.

આંકોદ ગામનાં યુવાનો દ્વારા જુની તરસાલી ગામનાં ખેડૂતોને કૃષિ કીટ વિતરણ કરવામાં આવી

। મલેક ચણદાની ભરૂચ, તા.૩ । ભરૂચ જિલ્લામાં પાંચ દાયકા બાદ આવેલ સૌથી મોટા પુરના કારણે સમગ્ર જિલ્લાના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે ઝઘડિયા વિસ્તારના નદી કાંઠાના ગામોના ખેડૂતોને પણ ભારે નુકશાન થયું હોય માંગરોળ તાલુકાના આંકોદ ગામનાં યુવાનો દ્વારા જુની તરસાલી ગામના ખેડૂતોને મદદ રૂપ થવાના હેતુ થી કૃષિ કીટ વિતરણ કરવામાં આવી હતી. નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે ત્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પોડિતોના વ્યારે આવી દરેક રીતે મદદરૂપ થઈ રહી છે



ત્યારે ખેતી અને પશુપાલન કરી પોતાનું જીવન નિર્વાહ કરતા જુની તરસાલી ગામના ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ હતી ત્યારે શનિવારે આંકોદ ગામના યુવાનો દ્વારા જુની તરસાલી ગામના ૮૦ જેટલા ખેડૂતોને બિયારણ, ખાતર તેમ જ પાક જંતુનાશક દવાઓ સહીત કૃષિ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં માસ્ટર ઈબ્રાહિમ, કારી અમ્માર ભાઈ, ફાઝલ ભાઈ અહતા, જુનેદ ભાઈ પાંચભાયા, જેનુલ ભાઈ કાજી, સાજીદ ભાઈ મુલ્લા, સુફિયાન કાજી તેમ જ આંકોદ ગામના યુવાનોએ ભાગ લીધો હતો.

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો અમદાવાદમાં ડેન્ગ્યુનો ફેર : મચ્છર/પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

। અમદાવાદ, તા.૩ । અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુનાં ૭૦૮ કેસ નોંધાયા છે. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોર્ગિંગની અને દવા છંટકાવની કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી જેથી રોગચાળો વકર્યો છે. આ બાબને એએમસીનાં આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઢાલમાં મચ્છરજન્ય કેસ બાબતે ચાલુ માસ દરમ્યાન ડેન્ગ્યુનાં ૭૦૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાદા મલેરિયાનાં ૧૪૮ રિપોર્ટ થયેલા છે. ડેન્ગ્યુની વાત કરીએ તો છેલ્લા મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં કેસમાં ઘટાડો જોવા મળેલો છે. ઢાલમાં વરસાદનું પ્રમાણ પણ



ઓછું થયેલું છે. તેમજ મચ્છરનાં બ્રિડીંગની ફરિયાદ પણ કોર્પોરેશનમાં ઓછી નોંધાવવા પામી છે. તેમજ કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જાડા ઉલ્ટીનાં ૪૮૪ કેસ, કમળાનાં ૧૯૨ કેસ અને ટાઈફોઈડનાં ૪૪૭ કેસ તેમજ કોલેરાનાં ૩૩ કેસ નોંધાયેલા છે. શહેરમાં વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અર્બન હેલ્થ સેન્ટરો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કેસો જોવા મળી રહ્યા છે. મિશ્રજંતુને કારણે હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસ પણ વધ્યા છે. છસ્સા અર્બન હેલ્થ સેન્ટરમાં દરરોજ ૧૫૦૦ જેટલી ઓપીડી નોંધાઈ રહી છે.

પરિવારો પર જાણે આભ તૂટ્યું રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ યુવાનોના હાર્ટ એટેકથી મોત

। રાજકોટ, તા.૩ । વર્તમાનમાં હૃદય ધબકારા યુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉંમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઠી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટી છે. બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશા માટે મૃત્યુ શૈયામાં પોઠી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ

પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે અને એટલે જ આવા કિસ્સા તરફ સમાજ કદાચ વધુ સંવેદનશીલ નહોતો. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. શહેરની ઓંબિકા ટાઉશીપ માં રહેતા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ૩૫ વર્ષીય લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર ગઈકાલે સવારે તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેઓનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. તો રાજકોટના કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ભૂત ખોરાણે ગામે આવેલી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી ખેતર ખાતે હાજર ખેતમજૂરો તેમને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિષ્કર્ષ્યું હતું.

લેબના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજી આણંદ પાસે હાઈ સ્પીડ રેલ ટ્રેક સ્લેબ નિર્માણ સુવિધાની શરુઆત

। અમદાવાદ, તા.૩ । મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બેલાસ્ટ લેસ ટ્રેક વર્ક્સના નિર્માણ માટે જરૂરી ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે નવી ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (TSMF) ગુજરાત રાજ્યના આણંદ નજીક મુલ્લી મુકવામાં આવી હતી. આ સુવિધા ૧ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે અને MAHSR પ્રોજેક્ટ માટે ૪૫,૦૦૦ પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. સિવિલ વર્ક્સની શરૂઆતના આઠ મહિનાની અંદર સમગ્ર સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુવિધામાં ૬૦ ઉચ્ચ-ગોકસાઈવાળા મોલ્ડ મેગવવામાં આવ્યા છે અને સ્થાપિત કરવામાં આવ્યા છે જે દરરોજ ૬૦ ટ્રેક સ્લેબ બનાવી શકે છે. ટ્રેક કિલોમીટર દીઠ અંદાજે ૨૦૦ ટ્રેક સ્લેબ જરૂરી છે. સીમલેસ ટ્રેક ઈન્સ્ટોલેશનની સુવિધા માટે આ સુવિધા ૯૦૦૦ ટ્રેક સ્લેબ સુધી સ્ટોર કરી શકે છે.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત
દૈનિક સમાચાર ૫૫

ઉપાડો ફોન
9800708900

આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો

આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વીડીયો મોકલી આપો

દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આપવી લેતુ અખબાર "ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત" દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો...

cnngujarat@gmail.com